

સારવારની શરૂઆત કર્યા પછી :

પ્રશ્ન -૧

મનોચિકિત્સકે આપેલી દવાઓ લેવાથી હું અસ્વસ્થતા અનુભવું છું. શું હું દવાઓ મારી મેળે ઘટાડી કે બંધ કરી શકું ?

ઉત્તર-૧

પોતાની રીતે દવાઓ ઘટાડવાથી કે અચાનક બંધ કરી દેવાથી માનસિક રોગના લક્ષણો નો હુમલો પાછો આવવાનો સંભવ હોય છે ? એકદમ દવા બંધ કરવાથી પણ દરદીને પરેશાની થાય છે. જો તમને હાલની દવાના ડોઝથી તકલીફ થતી હોય તો એની તમારા મનોચિકિત્સક સાથે ચર્ચા કરો. તમને અનુકૂળ આવે તે પ્રમાણે તેઓ ડોઝ ગોઠવી આપી શકે છે. (ઉત્તાવળે આંબા ન પાકે).

પ્રશ્ન-૨

જો હું દવાના એકાદ-બે ડોઝ ભૂલી જાઉં તો ?

ઉત્તર-૨

દવા જ્યારે નિયમિત સમયપ્રમાણો લેવાની રહી ગઈ હોય તો પણ બે ખોરાક સાથે લેવાની જરૂર નથી. બીજો ડોઝ એના સમયે લઈ લેવો. એ સાથે જ રોગના લક્ષણો જેમ કે ચીડીયાપણું. ઊંઘમાં ફેરફાર વિગોરે જો ફરીથી લાગે તો તરત જ તમારા મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.

પ્રશ્ન-૩

ગાયા વખતે મારાથી ૪-૫ દિવસ દવાઓ લેવાઈ ન હતી. એના પછી મને અનિદ્રા, ચીડીયાપણું, અને ઉશ્કેરાટ લાગે છે. શું એ દવાઓના કારણે હોય શકે ?

ઉત્તર-૩

અમૃત પ્રકારની દવાઓ જો અચાનક બંધ કરી દેવામાં આવે તો આવા ચિહ્નનો જણાય શકે છે. કયારેક આ ચિહ્નનો રોગના ઉથલાના પણ હોય શકે. દરદીએ બને ત્યા સુધી એક પણ ડોઝ જવા દેવો જોઈએ નહિ એનું કારણ ગમે તે હોય જેમ કે :

- ૧) બજારમાંથી દવા મેળવવાની મુશ્કેલી અથવા સમયસર ખરીદવાની આજસ
- ૨) પ્રયોગાત્મક ધોરણો દવા જાણી જોઈને બંધ કરવી,
- ૩) મનોચિકિત્સક પાસે નિયમિત ન જવું અથવા દવા બાબત અંગત વ્યક્તિની દેખરેખનો અભાવ.

માનસિક સારવાર બંધ કરવાનો નિર્ણય તમારા મનોચિકિત્સક જ લઈ શકે. સામાન્ય રીતે દવાઓ ધીમે-ધીમે ઘટાડીને બંધ કરવી જોઈએ જેથી એના વિપરીત લક્ષણો નિવારી શકાય.

પ્રશ્ન-૪

શું મારે આ દવાઓ ઉપર જ જીવવું પડશે ?

ઉત્તર-૪

અમૃક હઠીલા અને જટિલ માનસિક રોગોની સારવાર લાંબા ગાળા માટે ચાલુ રાખવી જરૂરી હોય છે. જો સારવાર બંધ કરવામાં આવે તો રોગ ફરી હુમલો કરી શકે જેને કાબૂમાં લાવવામાં વધુ તકલીફ પડે. આ પણ બ્લડપ્રેશર અને ડાયાબીટીસ જેવું જ છે જેમાં બીમારીને કાબૂમાં રાખવા દવા લાંબો વખત લેવી જોઈએ.

એની સામે, અમૃક માનસિક બીમારીઓ એવી પણ છે કે જેમાં દવાઓ ટૂંકા સમય માટે-થોડા મહિનાથી બે વરસ સુધીના સમય ગાળા માટે જ લેવાથી રોગ કાબૂમાં આવી જાય. દવાઓ સાથે માનસોપચારની બીજી પદ્ધતિઓનો પણ આ રોગોમાં જરૂર મુજબ ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન-૫

મારા હંમેશાના કેમીસ્ટે મને આ દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગાર આપવાની મનાઈ કરી છે. હવે મારે શું કરવું જોઈએ ?

ઉત્તર-૫

માનસિક રોગ માટેની દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગાર આપવાની કાયદો મનાઈ કરે છે. વળી, અમૃક દવાઓ ખૂબ જ કાંઈ ફાયદા હેઠળ હોઈને બધા કેમીસ્ટ અને માટેનો પરવાનો ધરાવતા નથી. તમારે તમારા મનોચિકિત્સકની જ મદદ આ માટે લેવી પડશે.

પ્રશ્ન-૬

મને સાધારણ સરદી, ખાંસી છે.

૧) શું આ દવાઓ સાથે મારું હંમેશાનું કફ્ફસિરપ લઈ શકું ?

સરદી, ખાંસીની અમૃક દવાઓ કયારેક ઘેન પેદા કરે છે. પણ એ સિવાય એ દવા તમારી દવાઓ સાથે લેવામાં બીજો કોઈ વાંધો નથી.

૨) શું હું એન્ટીબાયોટીક અને દરદશામક દવાનો આ દવાઓ સાથે લઈ શકું ?

ઉત્તર-૬

મોટા ભાગની સાઢી સરદી, ખાંસી તાવની દવાઓ આ દવાઓ સાથે લેવામાં આવે તો કોઈ નુકશાન કરતી નથી. તમે જ્યારે પણ, બીજા કોઈપણ તબીબની તમારી તકલીફ માટે સલાહ લો ત્યારે તમારા મનોચિકિત્સકે આપેલી દવાઓ એમને બતાવવી જ જોઈએ.

પ્રશ્ન-૭

મને જો કોઈ મેડીકલ, સર્જુકલ કે ગાયનેકોલોજુકલ તકલીફ હોય તો પણ શું મારે પહેલા મારા મનોચિકિત્સકને એના વિષે જણાવવું જોઈએ ?

ઉત્તર-૭

જો બીજુ શારીરિક બીમારી ગંભીર હોય તો એના માટેના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરને વગાર વિલંબે બતાવી શકાય. પરંતુ દરદીએ એ મનોવિકાર માટેની જે દવાઓ લે છે તેના વિષે તથીબને જરૂર માહિતગાર કરવા જોઈએ.

પ્રશ્ન-૮

બીજુ દવાઓ શરૂ કરતાં પહેલા શું મારે મારા મનોચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે ?

ઉત્તર-૮

જો તમે તમારા ડોક્ટરને તમારી મનોવિકારની દવા વિષે જણાવ્યુ હશે તો જરૂર લાગશે તો એજ તમને તમારા મનોચિકિત્સકની સલાહ લેવાનું કહેશે. જ્યારે તમારા મનોચિકિત્સક પાસે જવાનું હોય ત્યારે તમે તમારા આ ડોક્ટરના રીપોર્ટ, પ્રિસ્ક્રીષન વગેરે સાથ લઈ જઈને એમને બતાવી શકો છો.

બીજા રોગ માટેની દવા વધવાના કારણે તમારે તમારી મનોચિકિત્સક આપેલી દવાઓ એમની સલાહ વગાર બિલક્કુલ ઘટાડવી જોઈએ નહિં. (બહુ બધી દવાઓ થઈ ગઈ છે એમ માનીને)

પ્રશ્ન-૯

આ દવાઓને લગતી બીજુ શું સાવચેતીઓ છે ?

ઉત્તર -૯

- મનોવિકારની દવાઓનો જાણતા કે અજાણતા દુરૂપયોગ ન થાય એવા સ્થાને મુકવી જરૂરી છે.
- તમે વાહન હંકારી શકો કે નહિં એ પણ તમારા મનોચિકિત્સકને દવા શરૂ કરતા પહેલાં પૂછી લો. દવાની અસર અને ડોઝને લીધે જાયતતા પર અસર પડી શકે એટલે એવા સમયે વાહન હંકારવું હિતાવહ નથી, ખાસ કરીને ઇલાજની શરૂઆતમાં દવાની અસરને લીધે શરીરની પ્રતિક્રિયા(રીફ્લેક્સીસ) થોડી મંદ પડી શકે એટલે આ સાવચેતી જરૂરી છે. ડોક્ટરને જ્યારે ડોઝ અને પ્રતિક્રિયા અનુકૂળ લાગે ત્યારે એ છૂટ આપવાનું વિચારી શકે.
- આ દવાઓ સાથ દારનું સેવન કરવું ન જોઈએ. જો તમારે કોઈ સમાજુક મેળાવડામાં એકાદ-બે પેગ પીવાના હોય તો તમારા ડોક્ટરની પહેલા મંજુરી મેળવી લો. દાર પીવા માટે દવા લેવાનું કદી પણ ટાળવું જોઈએ નહિં.

- સ્ત્રીઓ માટે :

સ્ત્રીઓનાં માસિક ચકમાં ફેરફાર થઈ શકે છે. એ દવા અથવા રોગના કારણે પણ હોઈ શકે અને એની ફીકર કરવાની જરૂર નથી. બીજુ તપાસ માટે દોડી જતા પહેલા તમારા મનોતત્ત્વ સાથે આ વિષે ચર્ચા કરી લેવી.

- ગર્ભાવસ્થાને સમયી :

તમને બાળક જોઈતું હોય તો તમારા મનોચિકિત્સકને એ વિષે માહિતગાર કરવાથી એ તમને ગર્ભધાન સાથે સુરક્ષિત હોય એવી દવાઓ આપી શકે અને બીજુ જરૂરી ચર્ચા કરી શકે. જો કુટુંબનિયોજનનું સાધન વાપરતાં હોય તો એમા બેદરકારીને અવકાશ ન હોવો જોઈએ.

બીજુ કોઈ જરૂરી સાવચેતી વિષે તમારા મનોચિકિત્સક તમને જરૂર જણાવશે.

પ્રશ્ન-૧૦

મારા પુત્રની ત્રણ મહિનાથી માનસિક સારવાર ચાલતી હતી અને હવે તે સંપૂર્ણ સ્વર્ણ છે. છતાં પણ અમારા મનોચિકિત્સક એની દવાઓ હજુ ચાલુ રાખવા માટે કહે છે. શું એ જરૂરી છે ?

ઉત્તર-૧૦

દવાના સુધારો પાકો કરવા અને અધૂરા ઇલાજથી આવતો ઉથલો રોકવા આવી 'મેઇન્ટેનન્સ' સારવાર જરૂરી છે. દરેક દવાઓ અમુક સમય માટે ચાલુ રાખવી જરૂરી બને છે. એને કેટલો વખત ચાલુ રાખવી એ તમારા મનોચિકિત્સક જ નક્કી કરી શકે.

પ્રશ્ન-૧૧

શું હું મારા મનોચિકિત્સકે પહેલા આપેલી દવાઓ હજુપણ તેમને પૂછ્યા વગાર ચાલુ રાખી શકું ?

ઉત્તર ૧૧

તમારા મનોચિકિત્સક પાસે તમારે નિયમિત બતાવવા જવું ખૂબ જ જરૂરી છે. કારણ કે :

- ૧) દવાઓના ડોઝમાં તમારા રોગના લક્ષણો પ્રમાણે વખતોવખત ફેરફાર કરવો જરૂરી બને છે.
- ૨) એકના બદલે બીજુ દવા કે એજ દવાના ડોઝમાં ઘટાડો પણ જરૂરી હોય શકે
- ૩) કેટલીક દવાઓ લેતી વખતે લોહીની વખતોવખત ચકાસણી જરૂરી હોય છે.
- ૪) ડોક્ટર કોઈપણ સાઈડ-ઇફેક્ટ-(આડઅસર) ને તરત નોંધીને ચોગ્ય પગાલાં લઈ શકે.
- ૫) જો કોઈ વધુ સારી દવા બજારમાં આવી હોય તો તમારા ડોક્ટર તમને એની ભલામણ કરી શકે.
- ૬) તમે જો લાંબો સમય એક જ જાતની દવાઓ પોતે ચાલુ રાખો તો તમને તેની આદત થઈ શકે અથવા શક્ય છે કે દવા તમને અસર ઓછી કરે.
- ૭) તમારા ડોક્ટર ફક્ત દવાથી જ તમારો ઉપયાર નથી કરતા પણ તમને માનસોપયારની બીજુ

પદ્ધતિઓથી પણ સારવાર આપે છે. એ પણ સારવારનો મહત્વના ભાગ છે.

તમારી સારવાર તમારા મનોચિકિત્સકની દેખરેખ હેઠળ જ થવી જરૂરી છે માટે કદાપિ જાતે દવાઓ ચાલુ રાખવાનો પ્રયત્ન પણ કરવો ન જોઈએ. એમાં શક્ય છે કે થોડા પેસા બચાવવામાં કચારેક વધુ નુકશાન થઈ જાય.

પ્રશ્ન-૧૨

જ્યારે પણ મારી દવા મારા મનોચિકિત્સકે બંધ કરી છે ત્યારે મારા રોગના લક્ષણો ફરી દેખાવા લાગે છે. આનો અર્થ શું એમ થાય કે મને આ દવાઓની ટેવ પડી ગઈ છે? એ લીધા વિના ચાલશે જ નહિ?

ઉત્તર-૧૨

આ તર્કપ્રમાણો તો બી.પી અને ડાયાબીટીસની દવાઓનું પણ બંધાણ જ કહેવાય!

આ કોઈ લત કે વ્યસન નથી પણ અમુક દવાઓ લાંબો સમય ચાલુ રાખવાથી જ રોગના લક્ષણો કાબૂમાં રહે છે. એનું કારણ એ છે કે :

- ૧) ઘણી વખત, રોગનો દરેક લક્ષણ બિલકુલ મટાડી ન શકાય પણ દવાઓથી તેને કાબૂમાં રાખી શકાય.
- ૨) અમુક માનસિક રોગોમાં આનુવાંશિક કે શારીરિક કારણ મોટો ભાગ ભજવે છે. જેથી માનસોપચારની બીજી પદ્ધતિઓ આમાં એટલી કારગત નથી નીવડતી.
- ૩) લાંબા સમયથી સારવાર ન થઈ શકી હોય એવા માનસિક રોગમાંથી એકવાર રાહત મળ્યા પછી પણ દવાઓ લાંબો સમય સુધી ચાલુ રાખવાથી ફરીથી એ રોગનો હુમલો ટાળી શકાય છે.
- ૪) અમુક રોગો જેમ કે બાઈપોલર મૂડ ડીસાર્કર કે જેમાં હતાશા અને ઉન્માદ બંનેના લક્ષણો વારાફરતી જોવા મળે એવા દરદીઓને મૂડસ્ટેબીલાઝર પર લાંબો સમય સુધી રાખવા જરૂરી છે.

પ્રશ્ન-૧૩

દવાઓ સિવાય દરદીને મદદ કરવાના બીજા ઉપાયો છે?

ઉત્તર-૧૩

માનસિક રોગોની સારવારમાં દવાઓ સિવાયની પણ ઘણી ઉપચાર પદ્ધતિઓ વાપરવામાં આવે છે કે જેનાથી રોગ પર વધુ સારું નિયંત્રણ રાખી શકાય.

આ પદ્ધતિઓ તમારા મનોચિકિત્સક પોતે અથવા તો એમની દેખરેખ હેઠળ મનોચિકિત્સાના વિવિધ નિષ્ણાતોની ટીમની મદદથી રોગના ઈલાજ માટે વાપરી શકાય. જેનાથી સામાજુક, તેમજ ધંધાકીય સંઘર્ષ કે પરસ્પરના સંબંધોમાં તનાવ ઘટાડી શકાય છે.

સહાયક સંસ્થાઓ (સપોર્ટ ગ્રુપ અને એન.જી.ઓ.) પણ સારવારમાં પીઠબળ આપવાનું કામ કરે છે. દા.ત. આલ્કોહોલીક એનોનીમસ (A.A.) દારુના સેવનથી વ્યસનીઓને મુક્ત રાખવામાં મદદ કરે છે.

દરદીના સાજા થચા બાદ એનું સામાજુક તેમજ વ્યવસાયિક પુનર્વસન પણ ખૂબ જ જરૂરી હોય છે.

પ્રશ્ન-૧૪

વ્યક્તિના ધંધા કે નોકરી પર એના માનસિક રોગ કે એની સારવારની અસર થઈ શકે ?

ઉત્તર-૧૪

વ્યવસાયિક કામગીરીમાં સ્થિરતા લાવવા માટે માનસિક રોગનો ઈલાજ થવો અત્યંત જરૂરી છે. સારવાર ન પામેલા મનોરોગીએ ને નીચે જણાવ્યા પ્રમાણે ધંધાકીય તકલીફ થઈ શકે.

- ૧) કામ પર ગોરહાજરી
- ૨) એકાચ્યતાનો અભાવ તેમજ કથળેલી કામગીરી
- ૩) ધંધાના નિર્ણય લેવામાં વિલંબ
- ૪) નિષ્ફળતા
- ૫) નોકરી ગુમાવવી
- ૬) આર્થિક સંકડામણા, પરસ્પરના સંબંધોમાં સંઘર્ષ, હોદ્દો ગુમાવવો કે દરદીની માનહાનિ થવી.

રોગના પ્રકાર અને તીવ્રતા પર આ બધી અસરો અવલંબે છે એટલે કયારેક વ્યવસાયિક ક્ષેત્રે થોડો ફેરબદલ જરૂરી બને છે. સારવારના લીધે વ્યવસાયમાં તકલીફ થવાની શક્યતા માયુલી હોય છે પણ અધકચર્ચી અથવા બિલકુલ સારવાર ન કરવાના પરિણામ ઘણા માઠાં હોય છે.

પ્રશ્ન-૧૫

મારા થુવાન દીકરાની માનસિક સારવાર ચાલુ છે અને એને થોડું સાર છે. પરંતુ, એ છોકરીઓની અને લગન કરવાની વાતો કરે છે. શું એના લગન કરવાથી એને રોગમાંથી મુક્તિ મળી શકે ?

ઉત્તર-૧૫

લગન કરવાથી માનસિક રોગમાંથી મુક્તિ મળે એ તદ્દત પાચાવિછોણી માન્યતા છે. દરદી તો એના રોગને લીધે પ્રેમ, લગન કે સેકસની વાતો સંકોચ વિના કરે જે ગંભીરતાથી લેવાય નહિં.

માનસિક રોગને વ્યવસ્થિત કાબૂમાં લીધા પછી લગન માટે વિચારી શકાય. પરંતુ લગન એ માનસિક બીમારીનો ઈલાજ નથી.

પ્રશ્ન-૧૬

જો દરદી સાબે થઈ જાય અને બહું થોડી જ દવાઓ ચાલુ રાખવી પડે તો શું એના લગ્ન અને બાળકો માટે વિચારી શકાય ?

ઉત્તર-૧૬

લગ્ન થવાથી વ્યક્તિની પોતાની સામાજુક તેમજ આર્થિક જવાબદારી વધી જાય છે. અહીં તમારા મનોચિકિત્સક સાથે ચર્ચા વિચારણા કરીને જ એના વિષે નિર્ણય લઈ શકાય.

આમાં કેટલાક પરિબળોની જેવાં કે રોગના લક્ષણો, તેને કાબૂમાં રાખતી દવાઓ, જવાબદારી લેવાની યોગ્યતા વિગોરે બાબતોની તેના ભાવિ પતિ/પત્ની અને તેના કુટુંબ સાથે ચોખવટ કરી લેવી જોઈએ. આટલો મહત્વનો નિર્ણય ફક્ત સામાજુક દબાણથી લેવો અયોગ્ય છે.

બાળકો થવા જોઈએ કે નહિ એનો નિર્ણય પણ તમારા મનોચિકિત્સક સાથે ચર્ચા કર્યા પછી જ લેવાવો જોઈએ.

પ્રશ્ન-૧૭

મારા પડોશીને દસ વર્ષ પહેલાં માનસિક બીમારી માટે ઈ.સી.ટી. આપવામાં આવેલા. એમની દવાઓ તો હજુ પણ ચાલુ જ છે. પરંતુ હું હમણાથી એમને નિર્જિય અને તદ્દન સુસ્ત જીંદગી જીવતા જોઉં છું. શું આ ઈ.સી.ટી. અને માનસિક રોગની દવાઓની આડઅસર હશે ?

ઉત્તર-૧૭

કામ ન કરવું કે લોકો સાથે બિલકુલ હળવું મળવું નહિ એ તેમની બીમારીનો જ એક ભાગ હોઈ શકે છે. માનસિક રોગના શરૂઆતના તીવ્ર લક્ષણો કાબૂમાં આવી ગયાં હોય પણ બીમારીનો થોડો ભાગ હજુ બાકી જ હોય ત્યારે પણ આવુ બની શકે.

પરંતુ એટલું તો ચોક્કસ કે આ લક્ષણો ઈ.સી.ટી. કે દવાઓની આડઅસરના તો નથી જ.

પ્રશ્ન-૧૮ પુનર્વસન કેન્દ્ર એટલે શું ?

ઉત્તર -૧૮

દરદીને માનસિક સારવાર સાથે, રોકિંદી જીંદગી જીવવા માટે જ્યાં કાબેલ બનાવવામાં આવે અને આત્મનિર્ભર થવા માટે કંઈક હુશ્વર શીખવાડાય એ સંસ્થાને પુનર્વસન કેન્દ્ર કરું છે.

અહીનું માળખુ હોસ્પિટલ કરતા ઘર જેવું વધુ હોય છે.